

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં ગતિ મર્યાદાના ઉલ્લંઘનની ઝીરો ટોલરન્સ બ્રેમ્પટન સીટી કાઉન્સિલ માર્ગ સલામતી વધારવાના પ્રસ્તાવને બહાલી આપે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (13 જુલાઈ 2020) – જુલાઈ 8ના રોજ સિટી કાઉન્સિલે વાર્ષિક ધોરણે ગતિ મર્યાદા ઉલ્લંઘન અને યાતાયાત સંબંધિત ઘટનાઓ ઘટાડવાના ઈરાદાથી તેમજ બ્રેમ્પટનમાં તમામ વપરાશકર્તાઓ માટે માર્ગ સુરક્ષા વધારવા માટે 200 જેટલા ઠેકાણે ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE)ના આમલને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.

હાલમાં એવા પાંચ સ્થળો છે જ્યાં ASEની અધિસૂચના ધરાવતા ચિહ્નો લગાવવામાં આવ્યા છે જ્યાં સપ્ટેમ્બર 2020થી કેમેરા ઈન્સ્ટોલ થઈ જશે.

- વોર્ડ 1: વોડન સ્ટ્રીટ ઈસ્ટ (કિનેડી રોડ અને સેન્ટર સ્ટ્રીટ વચ્ચે)
- વોર્ડ 2: રિયવેલ ડ્રાઈવ નોર્થ (કિનેડી રોડ અને સેનડલવૂડ પાર્કવેની વચ્ચે)
- વોર્ડ 3: રે લોસન બૂલવર્ડ (હુરોન્ટારિયો સ્ટ્રીટ અને મેકલોઘલિન રોડ વચ્ચે)
- વોર્ડ 8: એવનડેલ બૂલવર્ડ (બ્રેમલિ રોડ અને બર્ચબેંક રોડ વચ્ચે)
- વોર્ડ 9: ફર્નફોર્સ્ટ ડ્રાઈવ (બોવેર્ડ ડ્રાઈવ અને સેનડલવૂડ પાર્કવે વચ્ચે)

સપ્ટેમ્બર 2020થી સિટી 25 વધુ [સમાજ સુરક્ષા ક્ષેત્રો \(Community Safety Zones\)](#) પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરી રહ્યા છે. આ શહેર ફરતે ASE ને મદદરૂપ થતા વધારાના કેમેરા ખરીદવાનું પણ સ્ટાફ દ્વારા શરૂ થશે. આ વર્ષેના અંત સુધીમાં પ્રાપ્તિની પ્રક્રિયા પૂરી થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

જાગૃક્તા ઊભી કરવાના પ્રયાસરૂપે શહેરના પ્રવેશ બિંદુઓ પર ચિહ્નો ઊભા કરાશે જ્યાં મોટરકાર ચાલકોને જાણ થાય કે ASE નો અમલ થઈ રહ્યો છે અને ગતિ મર્યાદાનું ઉલ્લંઘન સમાજમાં ક્ષમ્ય નથી.

પૃષ્ઠભૂ

- ASE જે પસંદગીની સહભાગી થતી સુધારાઈઓમાં રાજ્ય કક્ષાએ કાયદેસર થયું છે તે સ્થાનિક સમુદાયો માટે સલામતી અને સગવડતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે – ખાસ કરીને એવા માર્ગ વપરાશકર્તાઓ જેઓ વધુ સંવેદનશીલ હોય જેમકે બાળકો.
- ASE એક ઓટોમેટેડ સિસ્ટમ છે જે ગતિ મર્યાદા બજાવવા માટે કેમેરા અને ગતિ માપક ઉપકરણનો ઉપયોગ કરે છે.
- ASE માત્ર ત્યારે જ છબીઓ કેદ કરીને રેકોર્ડ કરે છે જ્યારે વાહનો શાળાના ક્ષેત્રો અને કમ્યુનિટી સેક્ટી ઝોન્સમાં જાહેર થયેલ ગતિ મર્યાદાને ઓળંગે છે. તે ન જોતા કે કોણ ચલાવે છે રજિસ્ટર થયેલ પ્લેટ ધારકોને ટિકિટો જારી કરવામાં આવે છે.

- કાયદો પરવાનગી આપે છે કે ASE શાળાના ક્ષેત્રો કે કમ્યુનિટી સેફ્ટી ઝોન્સમાં અને એવા રોડવે પર જ્યાં ક્લાક દીઠ 80કિમીની ગતિ નિર્ધારિત થઈ હોય ત્યાં ઈન્સ્ટોલ થનાર છે.
- સીટી ઓફ બ્રમ્પટન ઓન્ટારિયોની પહેલવહેલી એવી સુધારાઈ હતી જેમાણે ASEનો અમલ કર્યો જ્યાં પ્રથમ અધિસૂચનાનું ચિહ્ન 19 ડિસેમ્બર 2019ના રોજ ઊભું કરવામાં આવ્યું હતું.

ASE વિશે વધારાની માહિતી માટે અહીં [અહીં](#) ક્લિક કરો.

અવતરણો

બ્રમ્પટનમાં ગતિ મર્યાદાનું ઉલ્લંઘન બિલકુલ અક્ષમ્ય છે અને આપણી કાઉન્સિલ આ સંદેશ સ્પષ્ટ કરવા માટે પગલાં લેવાનું ચાલુ રાખશે. ઓટોમેટેડ સ્પિડ એનફોર્સમેન્ટ આપના શહેર ફરતે 200 જેટલા સ્થળો સુધી વધારવાના પગલાં લઈને અમે વાહનોના અકસ્માતો ઘટાડવા માટે અને તમામ માર્ગ વપરાશકર્તાઓ માટે સુરક્ષા વધારવાનું કાર્ય કરી રહ્યા છીએ ખાસ કરીને જેઓ સૌથી વધુ સંવેદનશીલ હોય."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટનમાં વધારાના ASE સ્થળો મંજૂર કરીને અમે તમામ મોટર વાહન ચાલકોને સંકેત આપી રહ્યા છીએ કે ગતિ મર્યાદાનું ઉલ્લંઘન આપણા સમુદાયમાં ચલાવી લેવાશે નહીં અને યાદ રાખવું રહ્યું કે માર્ગ બધા માટે છે. આ વર્ષે વોડન સ્ટ્રીટ પર ASE શરૂ કર્યા પછી કાઉન્સિલે પાસે જ વચગાળાની બાઈક લેન્સ પણ શરૂ કરી છે જેથી સુરક્ષિત સક્રિય પરિવહનને પ્રોત્સાહિત કરી શકાય. અમારી અગ્રીમતા લોકો માટે એવા માર્ગો બનાવવાની છે જેથી અમે આખા બ્રમ્પટનમાં થતી હિલચાલ સુરક્ષિત રાખી શકીએ!"

પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર , વૉર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"ઓટોમેટેડ સ્પિડ એનફોર્સમેન્ટ એક સ્મૃતિ કરાવનાર બાબત છે કે આપણે સહુએ ધીમા પડવાની જરૂર છે અને આપણે બધાં આપણા સમાજને સુરક્ષિત રાખવામાં સક્રિય ભૂમિકા ભજવીએ છીએ. ASE શરૂ કરનાર પ્રથમ શહેરો પૈકી એક તરીકે અમે અમારા નિવાસીઓને દર્શાવી રહ્યા છીએ કે તેમનું આરોગ્ય અને સલામતી સૌથી મહત્વની છે."

પૅટ ફોર્ટિની, રીજનલ કાઉન્સિલર , વૉર્ડ 7 અને 8 અને પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટનના ઉપપ્રમુખ

"તે સુનિશ્ચિત કરવા કે માર્ગો, કુટપાથ અને ટ્રાફિકની પ્રણાલિઓ સુરક્ષિત રીતે અને કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહી છે અમારી રોડ્સ મેન્ટેનન્સ એન્ડ ટ્રાફિક સર્વિસિસ ટીમ અનિવાર્ય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. COVID-19 ની મહામારી પહેલા અને તે દરમિયાન અમારા કર્મચારીઓ ઓટોમેટેડ સ્પિડ એનફોર્સમેન્ટને અમલી બનાવવા માટે પડદા પાછળ કાર્ય કરી રહ્યા છે જેથી આપણા સમાજના આરોગ્ય અને સલામતીને પ્રોત્સાહિત કરી શકાય."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca